

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૭/૦૬/૨૦૧૮ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

અમદાવાદ શહેર પોલીસ તરફથી કરવામાં

આવેલ પ્રશંસનીય/નોંધપાત્ર કામગીરી :-

સમાચાર યાદી નં.૧૦૬૯/૧૮

ગેરકાયદેસરની દેશી બનાવટની પીસ્ટલ નંગ-૧ તથા કારતુસ નંગ-૦૨ સાથે એક
ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી. કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર

સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી એસ.ઓ.જી.કાઇમ બ્રાન્ચ અમદાવાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી.કાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર નાઓએ શહેરમાં ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરી કરવા સારું સુચના કરેલ. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.ઓ.જી. ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ના અધિકારીશ્રીઓ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ફરતા ફરતા અમદાવાદ શહેર ઉજાલા સર્કલ જાહેર રોડ ઉપર આવતાં સાથેના હે.કો.ફીરોઝખાન નસરુદીન તથા પો.કો.ચેતનકુમાર રામુભાઇ નાઓની સંયુક્ત બાતમી હકીકત આધારે વોચ કરી રવિરાજ ઉર્ફે રવિ ગભરુ ભાઇ ધાધલ (કાઠી) ઉવ.૨૦ ધંધો:ખેતીકામ રહે, ચામુડા નગર સોસાયટી ચોટીલા,તા-ચોટીલા,જી-સુરેન્દ્રનગર વાળાને ઝડપી લેવામાં આવેલ. જેની અંગઝડતીમાંથી પીસ્ટલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- તથા કારતુસ નંગ-૨ કી.રૂ.૨૦૦/- તથા સ્વીફ્ટ ગાડી કી.રૂ.૩,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ. જેથી સદરહું આરોપીને અટક કરી તેના વિરુદ્ધમાં હથિયારધારા મુજબ ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરેલ છે. સદર આરોપી અગાઉ (૧) ચોટીલા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૧૫/૧૮ ઇપીકો કલમ ૩૦૭, ૧૨૦(બી), ૧૧૪ તથા આર્મ એક્ટ ૨૫(૧-બી)એ તથા (૨) સુરેન્દ્રનગર બામણબોર પો.સ્ટે.સે.ગુ.ર.નં.૩૦૩૬/૧૭ ઇપીકો ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) વિગેરે (૩) જસદણ પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૬૯/૧૫ ઇપીકો કલમ ૧૪૩, ૫૦૪, ૫૦૬(૨), આર્મ એક્ટ ૨૫(૧)એ તથા જીપી એક્ટ ૧૩૫ (૧) તેમજ ચોટીલા પોલીસ સ્ટેશનમાં બીજા મારામારીના ગુનાઓમાં પકડાયેલ છે.

રામોલ પોલીસ સ્ટેશન :-

સ્પા સેન્ટરમાં નકલી પોલીસ બની ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવી લેતા ઇસમોને પકડી પાડતી રામોલ પોલીસ

રામોલ પોલીસ સ્ટેશન ફસ્ટ ગુરનં ૯૫/૧૮ ધી ઇપીકો કલમ ૩૮૯.૧૭૦.૧૧૪ મુજબના કામના ફરિયાદી નામે સમીરખાન સલીમખાન પઠાણ ઉવ ૨૧ ધંધો વેપાર રહે- એ/૨૧ ગુલમહોર સોસાયટી જુહાપુરા બસ સ્ટેંડ પાસે સરખેજ અમદાવાદ નાઓની ફરિયાદના કામે ગઈ તારીખ ૪/૬/૧૮ ના કલાક ૧૯/૩૦ વાગ્યાના સુમારે ફરિયાદીની પુષ્પ કોમ્પલેક્ષ ખાતેના શોપ નં એ/૧૦૧ માં ન્યુ હેપી સ્પા નામનું મસાજ સેન્ટરમાં ચાર અજાણ્યા ઇસમો આવી પોતે કાઇમબ્રાંચના માણસ છીએ તેમ કહીને ફરિયાદીને તમો સ્પા સેન્ટરમાં છોકરીઓ રાખી ખોટા કામ કરો છો તમારી ઉપર બળાત્કારનો કેસ કરી ફીટ કરાવી દઇશ તેવી ધમકી આપી ફરિયાદી પાસેથી કોઇ કેસ નહી કરવા માટે રોકડ રૂપિયા ૧૧૦૦૦/ કઢાવી લીધેલ જે બાબતેનો ગુનો અત્રેના પોસ્ટે દાખલ થયેલ જે સંબંધે ઉપરી અધિકારીઓ તરફથી સુચના આધારે અમોએ સર્વેસ્કોડ પોસઇ શ્રી એ.ઓ.ભરવાડ નાઓને આ ગુનો શોધી કાઢવા સુચના કરેલતે આધારે તેઓ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોકો કીરીટસિંહ મહોબતસિંહ અને પોકો લાલજીભાઇ જહાભાઇ નાઓની બાતમી હકીક્ત આધારે આરોપીઓ (૧)નિલેશકુમાર ખ્યાતીલાલ જૈન ઉવ:૨૮ રહે:૩ કીર્તન એપાર્ટમેન્ટ રાજેન્દ્રપાર્ક ઓઢવ અમદાવાદ તથા નં.(૨) પ્રતીક વસંતભાઈ રાજગોર ઉવ:૩૦ રહે:સી/૫૦૧ સોહંગ હીલ એપાર્ટમેન્ટ આકુતી ટાઉનશિપની બાજુમાં નારોલ અમદાવાદ નં.(૩) વિશાલ વસંતભાઈ રાજગોર ઉવ:૩૩ રહે:સી/૫૦૧ સોહંગ હીલ એપાર્ટમેન્ટ આકુતી ટાઉનશિપની બાજુમાં નારોલ અમદાવાદ શહેર વતન:મુ.ગામ:વિહોડા તા:ખેરાલુ જી:મહેસાણા તથા નં.(૪) શ્યામ ઉપેન્દ્રકુમાર જોષી ઉવ:૨૪ રહે:સી/૪૦૧ સોહંગ હીલ એપાર્ટમેન્ટ આકુતી ટાઉન્શીપની બાજુમાં લાંભારોડ નારોલ અમદાવાદ શહેર મુળવતન ગામ:વડલીફળી ખેડબ્રહ્મા તા.હીમતનગર જી.સાબરકાઠા નાઓને તા.૬.૬.૨૦૧૮ ના કલાક ૧૩/૧૫ વાગે સીટીએમ એક્સપ્રેસ હાઇવે બસસ્ટેંડ આગળથી તેઓએ કઢાવી લીધેલ રોકડનાણાં રૂપિયા ૧૧,૦૦૦/ સાથે પકડી અટક કરી ગુનો શોધી આગળની તપાસ હાથ ધરેલ છે.

ઓઢવ પોલીસ સ્ટેશન :-

મિલકત સંબંધી ગુનાના આરોપીને પકડી પાડતી ઓઢવ પોલીસ સ્ટેશન પોલીસ.

મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર તથા મે.અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ સા.તથા મે.નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ સા.તથા મે.મદદનિશ પોલીસ કમિશ્નરશ્રી "આઈ"ડીવીજન અમદાવાદ શહેર.નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેક્ટર.ઓઢવ પો સ્ટેશન.નાઓ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચના આધારે સર્વે પો.સ.ઈ.એ.ડી.ભટ્ટ.તથા અ.હેડ.કોન્સ.અમરસિંહ રેવાભાઈ બન-૩૯૪૧ તથા અ.હે.કો.અજીતસિંહ માનસિંહ બન-૭૯૧૨ તથા પો.કો.ચંદ્રસિંહ લાખુભા બન-૫૮૮૯ તથા પો.કો.પંકજભાઈ નારાયણભાઈ બન-૧૦૧૯૦ તથા પો.કો.સંજયભાઈ નારસિંગભાઈ બ.નં-૪૯૭૯.નાઓ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે જીજે-૦૧-સીટી-૬૫૬૬ માં એચ.એસીડ.ભરેલ થેલી નંગ-પ.કિ.રૂ.૫૦૦૦૦/- તથા આઈસર ગાડીની કિ.રૂ.૬૦૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૬૫૦૦૦૦/- ના આધાર પુરાવા વગરના મુદ્દામાલ સાથે આરોપી સુખદેવભાઈ ધીરૂભાઈ સિંધા ઉવ.૩૦.રહે.બામણવાળુ ફળીયુ ગામ:કલમસર તા.ખંભાત.જી.ખેડા.નાને ઝડપી પાડી અત્રેના પ્રથમ ઓઢવ પો સ્ટેશન જા.જો.નં-૮૩/૧૮ થી જાણવા જોગ દાખલ કરી સીઆરપીસી.૧૦૨ મુજબ તપાસ તપાસ અર્થે કબજે કરી સીઆરપીસી ૪૧(૧)(ડી) મુજબ અટક કરવામાં આવેલ.જે જાણવા જોગની તપાસ દરમ્યાન ઉપરોક્ત મુદ્દામાલ ચોરીનો હોવાનું જણાતા અત્રેના ઓઢવ પો સ્ટેશન-ફ.ગુ.ર.નં-૧૧૮/૧૮ ઈપીકો કલમ.૪૦૭ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત આરોપીને તા.૦૫/૦૬/૧૮ ના કલાક.૨૨/૦૦ વાગે પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.જે ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે.

સુરક્ષા સેતુ રથ :

“ઓઢવ” પોલીસ સ્ટેશન વિસ્તારમાં સુરક્ષા સેતુ રથનું આયોજન કરી, “ઓઢવ” પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાગરીકોને સુરક્ષા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.